

2

m

P dr

61 21

Handwritten signature

3758

0.70

Handwritten mark

3758  
2021

Handwritten mark

# E- CHALLAN

Login ID DEN 2021029028845     
 BARCODE      
 Printed On 05/03/2021 20:44:56

Department	Superintendent of Stamps And Inspector General Of Registration	Payer Details		
Property Details	Changodar- Block no 16 & 17 Commercial Land	TAX ID (If Any)		
		PAN No. (If Applicable)	NA	
		Full Name	Pearl Liesure Private Limited	
		Address	Ahmedabad	
Office Name	S.R.O - Sanand	<div style="border: 2px solid black; padding: 5px; display: inline-block;"> <b>SND</b>                      3758   21  <b>2021</b> </div>		
Location	AHMEDABAD			
Year	2020-2021 One time			

Transaction No	Account Head Details	Amount (RS.)	Bank CIN	Date	Bank-Branch
10305578172672	Registration Fee (0030-03-104-00) 5500.00	5500.00	57000013551003005032182478	05/03/2021	SBIEPAY
<b>Total Amount :-</b>		<b>5500.00</b>			


Total Amount In Words :- Rupees Five Thousand Five Hundred Only

Remarks (If Any)



For, **PEARL LIESURE PRIVATE LIMITED**  
  
**Authorized Signatory**



  
 સમ રજીસ્ટર, સાંબંદ

**SS&IGR-GUJARAT**

(1) Stamp duty paid by the E-Challan is valid up to 6 months from the date of generation subject to provision of Sec52/c of the Gujarat stamp Act-1908.  
 Registration fee paid by E-challan is valid up to 4 month from the date of execution of the instrument, u/s.23 of the Registration Act-1908.  
 Disclaimer: This is a digitally system generated e-Challan, Which does not require signature.



सत्यमेव जयते

INDIA NON JUDICIAL

Government of Gujarat

Certificate of Stamp Duty

SND  
3758 | 21  
2021

Certificate No.	: IN-GJ24109546559256T
Certificate Issued Date	: 06-Mar-2021 01:06 PM
Account Reference	: SHCIL (FI)/ sh-ahd06/ AHMEDABAD/ GJ-AH
Unique Doc. Reference	: SUBIN-GJSH-AHD0684079392841311T
Purchased by	: PEARL LIESURE PVT LTD
Description of Document	: Article 36(b) Mortgage Deed - Without Possession
Property Description	: CHANGODAR TAL SANAND BLOCK 16 AND 17 PAIKI
Consideration Price (Rs.)	: 1,68,23,284 (One Crore Sixty Eight Lakh Twenty Three Thousand Two Hundred And Eighty Four only)
First Party	: PEARL LIESURE PVT LTD
Second Party	: STANDARD CHARTERED BANK
Stamp Duty Paid By	: PEARL LIESURE PVT LTD
Stamp Duty Amount(Rs.)	: 1,17,763 (One Lakh Seventeen Thousand Seven Hundred And Sixty Three only)



LB 0020546724

**Statutory Alert:**

1. The authenticity of this Stamp certificate should be verified at 'www.shcilestamp.com' or using e-Stamp Mobile App of Stock Holding. Any discrepancy in the details on this Certificate and as available on the website / Mobile App renders it invalid.
2. The onus of checking the legitimacy is on the users of the certificate.
3. In case of any discrepancy please inform the Competent Authority.

SND  
37583/21  
2021



For, PEARL LIESURE PRIVATE LIMITED  
*[Signature]*  
Authorised Signatory

SUPPLEMENTAL MEMORANDUM OF ENTRY FOR DEPOSIT OF TITLE DEEDS

On the 08 day of 03 2021, the person named in **Schedule C** hereinafter referred to as **Mortgagor/s** which expression shall, unless it be repugnant to the context or meaning thereof, be deemed to mean and include its successors) hereunder visited the office of **Standard Chartered Bank**, a banking company incorporated in England with limited liability by Royal Charter 1853 with Reference Number ZC18, having Principal Office in England at 1 Basinghall Avenue, London, EC2V 5DD, acting through its branch office inter alia, situated at the place as mentioned in **Item No. 2 of Schedule A** hereunder (hereinafter referred to as "**the Bank**", which expression shall, unless it be repugnant to the context or meaning thereof, be deemed to mean and include its successor and assigns) and delivered to and deposited by way of actual delivery with the person named in **Item 6 of Schedule A** of the Bank, the documents of title, evidences deeds and writings more particularly described in **Schedule D** hereunder written (hereinafter referred to as the "**Title Deeds**") in respect of the Mortgagor's immovable properties more particularly described in the **Schedule E** hereunder written.

*[Signature]*  
PEARL LIESURE PRIVATE LIMITED

For, PEARL LIESURE PRIVATE LIMITED  
*[Signature]*  
Authorised Signatory

SND  
3758 | 21  
2021

And while making the aforesaid deposit, the Mortgagor/s inter-alia stated that he/she had done so on behalf of the Mortgagor/s and in his/her capacity as the Mortgagor/s/authorized person on behalf of the Mortgagor/s with the intent to create first exclusive charge by way of mortgage by deposit of title deeds, on the Mortgagor's immovable properties together with all buildings and structures thereon more particularly described in the **Schedule E** hereunder written and all plant and machinery attached to the earth as per list attached or permanently fastened to anything attached to the earth (hereinafter collectively referred to as the "Immovable Properties") to secure due repayment, discharge and redemption by the person/s details of whom are described in **Schedule B** hereunder (referred to as the 'Borrower/s').

to the Bank of the various credit facilities, in all aggregating to the amount as detailed in **Item 4 of Schedule A** (hereinafter referred to as the "Principal Facility") granted / sanctioned by the Bank to the Borrower together with interest, default interest, additional interest, further interest, liquidated damages, interest tax, commitment and other charges/fee, premia on prepayment, indemnification payments, fee, financing charges, costs, commissions and all legal and other charges and expenses relating thereto or incidental to the Principal Facility and payable under the Finance Documents (as defined in the Facility Agreement (defined hereinafter)) on the terms and conditions set out in the Facility Letter/ Master Credit Terms (uncommitted) as detailed in **Item 3 of Schedule A** addressed by the Bank to the Borrower/s, as may be amended, modified or supplemented from time to time (hereinafter referred to as the "Facility Agreement") and other Finance Documents (as defined in the Facility Agreement).

At the request of Borrower/s, the Bank has now agreed to increase the Principal Facility to an amount as detailed in **Item 7 of Schedule A** (hereinafter referred to as the "Revised Facilities") under the Emergency Credit Line Guarantee Scheme [ECLGS] dated 18/09/2020 which shall together with interest, default interest, additional interest, further interest, liquidated damages, interest tax, commitment and other charges/fee, premia on prepayment indemnification payments, fee, financing charges, costs and all legal and other charges and expenses relating thereto or incidental to the Revised Facilities and payable under the Finance Documents (as defined in the Facility Agreement) on the terms and conditions set out in the Facility Agreement as detailed in **Item 8 of Schedule A** (hereinafter collectively referred to as the "Secured Obligations") be secured by way of second charge over the Immovable Properties by way of mortgage of deposit of title deeds through constructive delivery of Title Deeds by the Mortgagor/s under the terms and conditions as mentioned in the Facility Agreement and under ECLGS guidelines.

The Mortgagor/s, on the same day, further orally confirmed to the representative of the Bank whose details are set out in **Item 9 of Schedule A** that the equitable mortgage by way of deposit of title deeds created by the Mortgagor/s and recorded under the Memorandum of Deposit Of Title Deeds ("Principal MOE"), details of which are set out in **Item 5 of Schedule A** in respect of the Immovable Properties shall be extended as and by way of further mortgage by deposit of title deeds by constructive delivery of Title Deeds relating to Immovable Properties so as to be a continuing security for the due repayment for the Secured Obligations.

The Mortgagor/s further stated that he/she was authorised to extend the charge, by way of equitable mortgage by deposit of title deeds by constructive delivery of Title Deeds relating to Immovable Properties, in favour of the Bank as aforesaid pursuant to the resolutions passed by the Board of Directors of the Mortgagor at its meeting, as detailed in **Item 10 of Schedule A** and he/she furnished a certified copy of the said the resolutions passed by the Board of Directors to the Bank and further stated that the said the resolutions passed by the Board of Directors were in full force and effect and binding on the Mortgagor/s. (This is applicable only if the Mortgagor is a Company)



For, PEARL LIESURE PRIVATE LIMITED  
*[Signature]*  
Authorised Signatory

SND

3758 | 3/21

2021

The Mortgagor/s further stated that the Mortgagor/s has a clear and marketable title to and is seized and possessed of or otherwise well and sufficiently entitled to the Immovable Properties and that save and except for the Mortgagor/s, no other person or persons have any right, title, or interest of any nature whatsoever in the Immovable Properties and that the Mortgagor/s has good right, full power and absolute authority to mortgage by deposit of title deeds and to transfer the Immovable Properties by deposit of Title Deeds.

The Mortgagor/s also stated that the Immovable Properties are (save and except for the mortgage(s) and charge(s) mentioned herein and created in favour of the Bank) not in any way encumbered or agreed to be encumbered either by way of mortgage, charge, lien (including negative lien), trust, sale, pledge or otherwise and the Mortgagor/s shall not howsoever alienate its/their share, right, title or interest in the Immovable Properties and that the Immovable Properties are free from all such claims and demands and that the same or any of them or any part thereof are not subject to any *lis pendens*, attachment or any other pending litigation or any process issued by any court or authority and that the Immovable Properties are in the exclusive uninterrupted and undisturbed possession and enjoyment of the Mortgagor/s since the date of purchase/acquisition thereof and no adverse claim has been made against the Mortgagor/s in respect of the Immovable Properties or any of them or any part thereof and the same are not affected by any notice of acquisition or requisition, and that no proceedings or claims or demands or proceedings, claims for recovery of any taxes, whatever are pending or initiated against the Mortgagor/s under the Income-Tax Act, 1961 or under any other law in force in India for the time being and that no notice has been received or served on the Mortgagor/s under the Income Tax Act, 1961 and/or under any other law and that there is no pending attachment whatsoever issued or initiated against the Immovable Properties or any of them or any part thereof.

The Mortgagor/s stated that the Title Deeds so deposited were the only documents of title relating to the Immovable Properties in the possession, power and control of the Mortgagor/s and that the Mortgagor/s has a clear and marketable title to the Immovable Properties.

The aforesaid constructive/actual deposit of Title Deeds was made by the Mortgagor/s in the presence of the person detailed in **Item 9 of Schedule A** of the Bank.



For, PEARL LIESURE PRIVATE LIMITED

*Ravi*  
Authorised Signatory

## SCHEDULE A

SND

3758

21

2021

Item	Details	Particulars
1	Date and place of execution of this ROM	Date: <u>08/03/2021</u> Place: AHMEDABAD
2	Branch Address of the Bank	Standard Chartered Bank- Gound Floor, Abhijit II, Nr Mithakali Six Road, Navrangpura, Ahmedabad-380009.
	Name and Date of Principal Facility Letter/s/Agreement/s/Master Credit Terms	Facility Letter dated : 04/03/2021
4	Nature/Details and amount of Principal Facility	Term Loan (LAP) - INR 8,52,78,185/-
5	Date when the Mortgagor(s) visited the Branch to create Principal MOE	/03/2021, Mortgage serial Number: <u>3754</u>
	Name of Bank Official in whose presence the Mortgagor(s) deposited the title deeds to create the Principal Facility	Mr. Ravi selarka
	Nature/Details and amount of Revised Facility	Term Loan (GIL) - INR 1,68,23,284/-
8	Name and Date of Revised Facility Letter/s/Agreement/s/Master Credit Terms	Facility Letter dated : 18/09/2020 bearing reference no. Our Ref: 3267452
9	Name of Bank Official in whose presence the Mortgagor(s) deposited the title deeds to create the Revised Facility	Mr. Ravi selarka
10	Date of Board Resolutions passed by the Board of Directors of the Mortgagor	Not Applicable

For, PEARL LIESURE PRIVATE LIMITED

Authorised Signatory



For, PEARL LIESURE PRIVATE LIMITED

Authorised Signatory

SND  
3758 | 7 | 21  
2021

**SCHEDULE B**  
(Name and address of the Borrower/s)

Sr. No.	Name and Address
	<p><b>Borrower: PEARL LEISURE PRIVATE LIMITED</b>  <b>Address:</b> GF SANGRILA GRAND OPP DIVYADHAM OPP RAMDEV MASALA, CHANGODAR, AHMEDABAD – 382213.</p> <p><b>Co-Borrowers:</b></p> <p>(1) <b>DAUVA ZAKIRHUSSAIN ISMAIL</b>  <b>Address:</b> GF SANGRILA GRAND OPP DIVYADHAM OPP RAMDEV MASALA, CHANGODAR, AHMEDABAD – 382213</p> <p>(2) <b>DAUVA MUKHTAR HUSAIN</b>  <b>Address:</b> GF SANGRILA GRAND OPP DIVYADHAM OPP RAMDEV MASALA, CHANGODAR, AHMEDABAD – 382213</p> <p>(3) <b>ISMALBHAI MAMJIBHAI DAUWA</b>  <b>Address:</b> GF SANGRILA GRAND OPP DIVYADHAM OPP RAMDEV MASALA, CHANGODAR, AHMEDABAD – 382213</p> <p>(4) <b>DAUWA AKBARALI ISMAILBHAI</b>  <b>Address:</b> GF SANGRILA GRAND OPP DIVYADHAM OPP RAMDEV MASALA, CHANGODAR, AHMEDABAD – 382213</p>



**SCHEDULE C**  
(Name and address of the Mortgagor/s)

Sr. No.	Name and Address
	<p>(1) <b>PEARL LEISURE PRIVATE LIMITED</b>  <b>ADDRESS:</b> GF SANGRILA GRAND OPP DIVYADHAM OPP RAMDEV MASALA, CHANGODAR, AHMEDABAD – 382213</p>



For, PEARL LEISURE PRIVATE LIMITED  
  
 Authorised Signatory



**SND**  
3758 | 8 | 21  
**2021**

**SCHEDULE D**  
(LIST OF DOCUMENTS OF TITLE, EVIDENCES, DEEDS AND WRITINGS)

S. No.	List of Documents
1	ALL THE DOCUMENTS ARE PREVIOUSLY STATED IN THE MORTGAGE DEED AND SAME IS ALREADY DEPOSITED FOR PROPERTY 1 AND PROPERTY 2.

**SCHEDULE E**  
(ADDRESS OF THE MORTGAGED PROPERTY/PROPERTIES)

S.No.	Address— BLOCK NO. 16 & 17 PEARL LIESURE PVT LTD
Property.1	IN RESPECT OF INDUSTRIAL /COMMERCIAL LAND ADM. 2866 SQ. MTS. ALONG WITH CONSTRUCTION FORMING PART OF BLOCK NO. 16 & 17 ADM. 2934 + 4957 PAIKKI 1509 + 1357 SQ.MTS. OF MOUJE CHANGODAR, SUB DISTRICT SANAND & REGISTRATION DISTRICT AHMEDABAD.

Dated at Ahmedabad this 08 day of 03 2021



For, PEARL LIESURE PRIVATE LIMITED  
*[Signature]*  
Authorised Signatory

For, PEARL LIESURE PRIVATE LIMITED  
*[Signature]*  
Authorised Signatory

SND  
3758 19/ 21  
2021

Pearl Liesure Private Limited  
Through Its Authorised Signatory  
Zakirhussain Ismail Dauwa

FOR PEARL LIESURE PRIVATE LIMITED

*Zakir Hussain*  
Authorised Signatory

In the presence of

1. Name, Address and Signature

*Sheikh Gulam Rasul*

*[Signature]*

Name, Address and Signature

*Muhammad Khalid Sum*

*[Signature]*



SND  
3758 | 10 / 21  
2021



ગામનું નામ : CHANGODAR

અનુક્રમણિકા નંબર - ૨

સબ-રજીસ્ટ્રાર કચેરી  
એસ.આર.ઓ - સાલંદ



દસ્તાવેજનો પ્રકાર અને અવેજ (લાકા પટાના ડિસ્સામાં આકાર પટે આપનાર અથવા પટે રાખનાર આપે છે તે જણાવવું)	સર્વે નંબર પેટા વિભાગ નંબર અને ઘર નંબર (જો કંઈ પણ હોય તો)	આકાર અથવા જુડી ક્ષેત્રફળ આપવામાં આવે ત્યારે તે.	દસ્તાવેજ કરી આપનાર પક્ષકારનું નામ અથવા દિવાની કોર્ટના હુકમનામાં અથવા આદેશના સંબંધમાં પ્રતિવાદીનું નામ	દસ્તાવેજ કરી લેનાર પક્ષકારનું નામ અથવા દિવાની કોર્ટના હુકમનામાં અથવા આદેશના સંબંધમાં વાદીનું નામ	સહીની તારીખ નોંધણીની તારીખ	પાનુંક્રમ, ચોલ્કામ અને મૂક નંબર	શ્રેણી
માલિકી ફેરખત/વેચાણ  શ્રી. ૧૫૦૦૦૦૦૦=૦૦	રે બ્લોક નં ૧૬ તથા ૧૭ ની ૨૯૩૪ ચો મી તથા ૪૯૫૭ ચો મી એમ કુલ મળી ૭૯૯૧ ચો મી પેકી ૧૫૦૯ ચો મી તથા ૧૩૫૭ ચો મી એમ કુલ મળી ૨૮૬૬ ચો મી જમીન તથા તેમાં ગ્રાઉન્ડ, ફર્સ્ટ, સેકન્ડ તથા થર્ડ ફ્લોર મળી ૩૪૯૦.૫૦ ચો મી. (વિલ્ડઅપ એરીયા) વાળી બાંધકામવાળી મિલકત બિન પ્રેતીની ઔદ્યોગિક અને વાણિજ્ય હેતુની જમીન	આકાર અથવા જુડી ક્ષેત્રફળ આપવામાં આવે ત્યારે તે.	તુરાબ હોટલ પ્રા.લી વતી અને તરફથી તેના ડીરેક્ટર રસુલભાઈ દાઉદભાઈ નેવા હોટલ સાબર પ્લાઝા એ નામની લાગીદારી પેઠી વતી અને તરફથી તેના લાગીદાર ઝાફરઅલી રસુલઅલી નેવા પોતે જાતે તથા નીચેના ના. ક. મુ તરીકે	સાંગરી-લા હોસ્પિટાલીટી પ્રા.લી વતી અને તરફથી તેના અધિકૃત ડીરેક્ટર અકબરઅલી ઉસ્માઈલભાઈ દાઉદવા	૨૧/૧૦/૨૦૧૧ ૨૧/૧૦/૨૦૧૧	૭૧૯૩	શ્રેણી



મુકાબલ કરનાર

ખરી નકલ

સબ-રજીસ્ટ્રાર

એસ.આર.ઓ - સાલંદ

Parmar Harshad V. ની તારીખ : ૨૧/૧૦/૨૦૧૧ ના રોજની

અરજી નંબર : ૬૫૪૮

પહોંચ નંબર : ૨૦૧૧૦૪૬૦૧૩૬૪

તારીખ : ૨૧/૧૦/૨૦૧૧

SND  
3758  
2021

સબ-રજીસ્ટ્રાર


એસ.આર.ઓ - સાલંદ

નોંધ: કોમ્પ્યુટર પ્રિન્ટમાં કોઈ પણ રીતે કરેલ સુધારો માન્ય ગણાશે નહીં.

અનુક્રમશિકા નંબર - ૨

સબ-રજીસ્ટ્રાર કચેરી  
એસ.આર.ઓ - સાણંદ

ગામનું નામ : CHANGODAR

દસ્તાવેજનો પ્રકાર અને અવેજ (લાડા પટાના કિસ્સામાં આકાર પટે આપનાર અથવા પટે રાખનાર આપે છે તે જણાવવું)	સર્વે નંબર પેટા વિભાગ નંબર અને ઘર નંબર (જો કંઈ પણ હોય તો)	આકાર અથવા જુડી ક્ષેત્રફળ આપવામાં આવે ત્યારે તે.	દસ્તાવેજ કરી આપનાર પક્ષકારનું નામ અથવા દિવાની કોર્ટના ફુકમનામા અથવા આદેશના સંબંધમાં પ્રતિવાદીનું નામ	દસ્તાવેજ કરી દેનાર પક્ષકારનું નામ અથવા દિવાની કોર્ટના ફુકમનામા અથવા આદેશના સંબંધમાં વાદીનું નામ	સહીની તારીખ નોંધણીની તારીખ	અનુક્રમ, વોલ્યુમ અને પૃષ્ઠ નંબર	શેરો
			૧).. અહેસાનઅલી મોહમલઅલી નેવા ૨).. આસીફઅલી અંકબરઅલી નેવા ૩).. મેહદીઅલી મોહમદઅલી નેવા ૪).. શેરઅલી રસુલઅલી નેવા ૫).. ગુલ્દીકાર ગુલામફુસેન નેવા ૬).. બેનઝીરબાનુ ગુલામફુસેન નેવા ૭).. રબીબબાનુ રસુલભાઈ નેવા ૮).. નઝમાબેન ઈસ્માલભાઈ નેવા...				

Parmar Harshad V. ની તારીખ : ૨૧/૧૦/૨૦૧૧ ના રોજની

મુકાબલ કરનાર

ખરી નકલ



અરજી નંબર : ૬૫૫૮  
પરિચય નંબર : ૨૦૧૧૦૨૦૧૩૨૫  
તારીખ : ૨૧/૧૦/૨૦૧૧

સબ-રજીસ્ટ્રાર  
એસ.આર.ઓ - સાણંદ

સબ-રજીસ્ટ્રાર  
એસ.આર.ઓ - સાણંદ

નોંધ: કોમ્પ્યુટર પિન્ટમાં કોઈ પણ રીતે કરેલ સુધારો માન્ય ગણાશે નહીં.



SND

3758/13/21

2021

OSV DECLARATION

Customer met person: YES / NO  
Met at:  Office /  Resi  
Document: Scan / Original / Download  
Customer Signature: YES / NO  
given for SCB Loan Bank A/c  
Name: MAULIK K. SHAH ID No. 1535552  
Signature: ..... Date & Time: 22/02/2022



GOVERNMENT OF INDIA  
MINISTRY OF CORPORATE AFFAIRS  
Registrar of Companies, Ahmedabad

RoC Bhavan, Opp Rupal Park Society, Behind Ankur Bus Stop, Naranpura Ahmedabad - 380013, Gujarat, INDIA

Certificate of Incorporation pursuant to change of name  
[Pursuant to rule 29 of the Companies (Incorporation) Rules, 2014]

Corporate Identification Number (CIN): : U55101GJ2011PTC065123

I hereby certify that the name of the company has been changed from SHANGRI-LA HOSPITALITY PRIVATE LIMITED to PEARL LIESURE PRIVATE LIMITED with effect from the date of this certificate and that the company is limited by shares.

Company was originally incorporated with the name SHANGRI-LA HOSPITALITY PRIVATE LIMITED

Given under my hand at Ahmedabad this Sixth day of October Two Thousand Fifteen.

Signature valid

Digitally signed by Ministry of Corporate Affairs - Govt of India  
Date: 2015.10.06 12:34:57 GMT+05:30

Rathod Kamleshkumar Gangjibhai  
Assistant Registrar of Companies  
Registrar of Companies  
Ahmedabad

Mailing Address as per record available in Registrar of Companies office:

PEARL LIESURE PRIVATE LIMITED  
11, Gadir Residency, Near Congress Bhavan, Kochrab, Paldi,  
Ahmedabad - 380007,  
Gujarat, INDIA



For, PEARL LIESURE PRIVATE LIMITED  
*[Signature]*  
Authorised Signatory




# Pearl of Heaven THE HOTEL

SND		
3758	14	21
2021		

I / We Director of Pearl Liesure Private Limited,

Mr. Zakirhussain Ismail Dauwa

Hereby appoint and authorize **ZAKIRHUSSAIN ISMAIL DAUWA** to appear act. plea on My/Our behalf in all proceeding for the assessment appeal etc. With power to receive on My/Our behalf copies of assessments, refund and appellate review, order, other documents, records etc. His explanations and statements will be binding on me/us.



Acceptance: Zakirhussain Ismail Dauwa

Signature:

For, PEARL LIESURE PRIVATE LIMITED

Authorized Signatory

PEARL LIESURE PVT. LTD.

Opp. Divya Dham Ashram, Sarkhej - Bawla Highway Road, Near Ramdev Masala Co., Changodar, Ahmedabad - 382213.  
 Ph.: 9033051525 / 26 / 27 / 28 / 29 ▲ E-mail: pearlthehotel@gmail.com ▲ Web: www.pearlthehotel.com



**SND**  
**3758** / 15 / 21  
**2021**

ભારત સરકાર

Unique Identification Authority of India  
 Government of India

નોંધણીની ઓળખ / Enrollment No.: 0623/00041/01699

To  
 જાકીરહુસૈન ઈસ્માઈલ દાઉવા  
 Zakirhussain Ismail Dauwa  
 S/O: Ismail Dauwa  
 11 Ghadeer Residency  
 Near Congress Bhavan Kochrab, Paldi  
 Ahmedabad City  
 Paldi  
 Ahmedabad City Ahmedabad  
 Gujarat 380007  
 9825020429

26/04/2018  
 117997057

ME179970571FH



તમારો આધાર નંબર / Your Aadhaar No. :

**2338 5438 9871**

મારો આધાર, મારી ઓળખ



ભારત સરકાર

Government of India



જાકીરહુસૈન ઈસ્માઈલ દાઉવા  
 Zakirhussain Ismail Dauwa  
 જન્મ તારીખ / DOB : 14/10/1976  
 પુરુષ / Male



**2338 5438 9871**


મારો આધાર, મારી ઓળખ

*Zakirhussain Ismail Dauwa*



## નિર્દેશ

- આધાર ઓળખનું પ્રમાણ છે, નાગરિકતાનું નહીં
- ઓળખનું પ્રમાણ ઓનલાઇન ઓથેન્ટિકેશન માં પ્રાપ્ત કરો.



- Aadhaar is proof of identity, not of citizenship.
- To establish identity, authenticate online.

- આધાર દેશભરમાં માન્ય છે .
- આધાર ભવિષ્યમાં સરકારી અને બિન-સરકારી સેવાઓનો લાભ મેળવવામાં ઉપયોગી થશે .
- Aadhaar is valid throughout the country .
- Aadhaar will be helpful in availing Government and Non-Government services in future



ભારતીય અનુચિત ઓળખાણ પ્રાધિકરણ  
Unique Identification Authority of India

સરનામું:  
પિતાનું/માતાનું નામ: ઈસ્માઈલ  
દાઉવા, 11, ઘટીર રેસિડેન્સી, કોંગ્રેસ  
ભવન પાસે, કોચરાબ, પાલડી,  
અમદાવાદ શહેર, અમદાવાદ, પાલડી,  
ગુજરાત, 380007

Address  
S/O: Ismail Dauwa, 11, Ghatiar  
Residency, Near Congress  
Bhavan, Kochrab, Paldi,  
Ahmedabad City, Ahmedabad  
Paldi, Gujarat, 380007

A handwritten signature in black ink.

भारत सरकार  
Government of India



शेख गुलामरसूल  
Shekh Gulamrasul  
जन्म तिथि/DOB: 13/03/1977  
पुरुष/ MALE

2727 0462 8966  
VID: 9128 4618 0437 7725

मेरा आधार. मेरी पहचान

SND  
3758 | 21  
2021

भारत सरकार  
Unique Identification Authority of India



पता:  
S/O मोहम्मदभाई, ड-२, अल हबीब फ्लैट, वेजलपुर, नगर  
हमजा फ्लैट, अहमदाबाद सीटी, अहमदाबाद,  
गुजरात - 380001

Address:  
S/O Mohamadhbhai, D-2, AL HABIB FLAT,  
VEJALPUR, NEAR HAMZA FLAT, Ahmadabad  
City, Ahmadabad,  
Gujarat - 380001

2727 0462 8966  
VID: 9128 4618 0437 7725

1847 help@uidai.gov.in www.uidai.gov.in

*Handwritten signature*

Registrar

भारत सरकार  
GOVERNMENT OF INDIA

कालुराम प्रजापत  
Kaluram Prajapat  
जन्म तिथि/ DOB: 11/05/1993  
पुरुष / MALE

8101 9440 2471

आधार-आम आदमी का अधिकार

SND  
3758 | 18 / 21

2021

भारतीय विशिष्ट पहचान प्राधिकरण  
UNIQUE IDENTIFICATION AUTHORITY OF INDIA

पता:  
आत्मज: भगवानलाल  
प्रजापत, पारडा थूर, पर्दा  
थूर, डूंगरपुर,  
राजस्थान - 314034

Address:  
S/O: Bhagwanlal Prajapat, par da  
thoor, Par da Thoor, Dungarpur,  
Rajasthan - 314034

8101 9440 2471

Aadhaar-Aam Admi ka Adhikar

काल



SND		
3758	14	21
2021		

(W) 08/03/2021 5:49 PM

Serial No. 3758 Presented of the office of the Sub-Registrar of S.R.O - Sanand Between the hour of 17 To 18 on Date 08/03/2021	Receipt No :- 2021029007780	
	<b>Received Fees as following</b>	<b>Rs.</b>
	Registration	5000.00
	Side Copy Fee (25)	500.00
	Other Fees	0.00
<b>TOTAL :-</b>		<b>5500.00</b>



20210305578172672



*Zakir Hussain*

PEARL LIESURE PRIVATE LIMITED THROUGH ITS AUTHORISED SIGNATORY ZAKIRHUSSAIN ISMAIL DAUWA

MANISHA AMBALAL KHORASAMA  
Sub Registrar  
S.R.O - Sanand

MANISHA AMBALAL KHORASAMA  
Sub Registrar  
S.R.O - Sanand

Sl.no	Party Name and Address	Age	Photograph	Thumb Impression	Signature
1	PEARL LIESURE PRIVATE LIMITED THROUGH ITS AUTHORISED SIGNATORY ZAKIRHUSSAIN ISMAIL DAUWA 11 GHADER RES,PALDI,AHMEDABAD	45			<i>Zakir Hussain</i>

Executing Party admits execution

SND		
3758	20	21
2021		

(W) 08/03/2021 5:49 PM

1 SHEKH GULAMRASUL  
VEJALPUR, AHMEDABAD



2 KALURAM PRAJAPATI  
DUNGARPUR, RAJASTHAN



State that they personally known above named  
executant and Indetifies him/them.

1. [Signature]

2. [Signature]

Date: 8 Month: March -2021



[Signature]

MANISHA AMBALAL KHORASAMA  
Sub Registrar  
S.R.O - Sanand

Received Copies of Certified Evidence of Seller, Buyer and  
Identifiers of Document

Date: 08/03/2021

[Signature]

MANISHA AMBALAL KHORASAMA  
Sub Registrar  
S.R.O - Sanand

SND

3758

21

21

2021

08/03/21 7:06:16 pm

Version:1.1.2019.4

1 Book No. 3758 Registered No.

Date : 08/03/2021

( MANISHA AMBALAL KHORASAMA )

Sub Registrar  
S.R.O - Sanand

